

July 30, 2024

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai – 400001
BSE Scrip Code: 522257
BSE Script ID: RAJOOENG

Sub: Submission of Advertisement of Notice of Record Date for Bonus Issue of Equity Shares published in Newspaper.

Ref: Regulation 30 and 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (SEBI Listing Regulations)

Dear Sir,

With reference to the captioned subject and pursuant to Regulation 30 and 47 of SEBI Listing Regulations, as amended, please find enclosed a copy of e-newspaper clippings of Notice of Record Date for Bonus Issue of Equity Shares published today i.e. on Tuesday, July 30, 2024 in the following newspapers:

1. **“The Indian Express”** - English Language National Daily
2. **“Financial Express”** - English Language National Daily
3. **“Financial Express”** - Gujarati Language Daily

Copy of newspaper clippings shall be available on the website of the Company at <https://www.rajoo.com/investorszone.html#sec4>

This is for your information and record.

Thanking you.
Yours faithfully,
For, **Rajoo Engineers Limited**

Khushboo C. Doshi
Managing Director
(DIN: 00025581)

Encl: a/a



Rajoo Engineers Limited

Regd. Office : Rajoo Avenue Survey No. 210, Plot No.1, Industrial Area, Veraval (Shapar) Dist-Rajkot - 360 024, Gujarat - India.

+91-97129-62704/52701/32706

+91-90990 96292

rel@rajoo.com





www.rajoo.com

CIN : L27100GJ1986PLC009212 GSTN : 24AABCR3204M1ZL





SALUTE THE SOLDIER

CENTRAL RESERVE POLICE FORCE




Odisha 30 July 2003
On 30 July 2003, troops of 34 Battalion of CRPF, along with state police, were returning in two vehicles after an operation. The lead vehicle hit a landmine detonated by Maoists, who then opened fire and attempted to loot weapons. Despite injuries from the blast, the troops onboard immediately retaliated, forcing the Maoists to flee. In this incident, five CRPF bravehearts attained martyrdom in the line of duty. The nation will forever remain indebted to them and their families.

CENTRAL RESERVE POLICE FORCE




Assam 30 July 2010
On 30 July 2010, troops of 12 Battalion of CRPF were moving in a convoy to the firing range at Rangaraj (Dakurbhita) after completing training under 11 Mt. Brigade. Between Agiya and Goalpara on Solmari-Goalpara road, Goalpara district, insurgents ambushed them, blasting an IED and opening fire. One vehicle was severely hit, injuring its occupants. Despite their injuries, the CRPF troopers retaliated, forcing the insurgents to flee. Five brave troopers, Shaheed HC Punam Chand, Shaheed HC M Venkatchalam, Shaheed L/Nk T Nageshwara Rao, Shaheed Ct Randhir Singh and Shaheed Ct Mangal Layek sacrificed their lives on same day while one braveheart Shaheed Ct Manoranjan Bora succumbed to his injuries on 2nd August, attaining martyrdom.

CENTRAL RESERVE POLICE FORCE



MANIPUR 29 July 1997
77 Battalion of CRPF was deployed in Manipur. On July 29, 1997, while returning from an operation, the troops were ambushed by insurgents who opened fire and retaliated, leading to a fierce encounter. Despite having no cover, they advanced with heavy fire, forcing the insurgents to flee. Six CRPF troopers, including Shaheed Nk Viridhi Chand, laid down their lives in service of the nation, attaining martyrdom.

CENTRAL RESERVE POLICE FORCE



Chhattisgarh 30 July 2016
On 30 July 2016, acting on credible intelligence of Maoist presence, 208 CoBRA launched an operation in the jungle near Gachanpalli, Bheji. As the troops advanced, Maoists ambushed them with indiscriminate fire and IEDs from well-entrenched positions. Despite the overwhelming attack, the troops retaliated swiftly, forcing the Maoists to flee. In the fierce battle, Constable Pranjal Pachani, though injured, fought valiantly and inflicted heavy damage on the Maoists before making the ultimate sacrifice. For his exemplary bravery, Constable Pranjal Pachani was posthumously awarded the Police Medal for Gallantry.

CENTRAL RESERVE POLICE FORCE



MANIPUR 30 July 2003
On 30 July 2003, extremists opened fire on troops of 28 Battalion of CRPF during area domination duty in the market. Shaheed Constable Kantha Raju sustained serious injuries but retaliated, causing the insurgents to flee. Despite a massive hunt, the insurgents could not be apprehended. The injured braveheart later succumbed to his injuries, attaining martyrdom.

CENTRAL RESERVE POLICE FORCE



ASSAM 29 July 2001
On 29 July 2001, CRPF troops of 128 Battalion launched an operation against insurgents in village Bhaukjay, PS Rangiya, district Kamrup. As they approached their target, the insurgents ambushed them with an IED blast and indiscriminate fire. Despite sustaining injuries, the troops launched a counterattack. In the ensuing fierce firefight, the insurgents fled. Three bravehearts—Shaheed Ct. Farooq Ahmed, Shaheed Ct. Pradeep Kumar, and Shaheed Ct. Parshu Ram Yadav—fought valiantly despite their injuries. Two succumbed on the same day, and Ct. Parshu Ram Yadav attained martyrdom on 30 July. The nation will forever remain indebted to them and their families.

INDO-TIBETAN BORDER POLICE (ITBP)



30 July 2024
ITBP salutes its braveheart Constable Harish Singh Dhama of 14th Battalion, who laid down his life in the line of duty on this day in Uttarakhand in 2019.
Resident of : Vill.- Khela, Distt.- Pithoragarh (Uttarakhand)

THE DOABA INDUSTRIAL & TRADING COMPANY PRIVATE LIMITED
Registered Office: E/4, Industrial Area, Yamuna Nagar, Haryana-135001
T- 01732-251467; F:01732-250468; e-mail: info@kctgroup.com
CIN: U74900HR1942PTC000443

NOTICE OF LOSS OF SHARE CERTIFICATE
Notice is hereby given that the following share certificate issued by ICICI Bank Ltd. ("the Company") is stated to have been misplaced and the registered share holder applied for issue of duplicate share certificate.

FOLIO NO.	REGISTERED SHARE HOLDER	CERTIFICATE NO.	DISTINCTIVE NO. FROM	DISTINCTIVE NO. TO	EQUITY SHARES
1598204	THE DOABA INDUSTRIAL & TRADING CO. PVT LTD	983164	5832193159	5832200824	7666

Any person who has / have a claim in respect of the said certificate should lodge his/her claim with all supporting documents with Company or Kfin Technologies Ltd, Sellemium Tower B, Plot 31-32, Gachibowli, Financial District, Hyderabad-500032. If now valid and legitimate claim is received within 15 days from the date of publication of this notice, the Company will proceed to issue duplicate share certificate to the share holder listed above and no further claim would be entertained from any other person.
Date: 30.07.2024
Place: Haryana

THE DOABA INDUSTRIAL & TRADING CO. PVT LTD
Name of the Share Holder

NATIONAL INSTITUTE FOR THE EMPOWERMENT OF PERSONS WITH INTELLECTUAL DISABILITIES (DIVYANGJAN)
Formerly National Institute for the Mentally Handicapped
Department of Empowerment of Persons with Disabilities (Divyangjan) (Ministry of Social Justice & Empowerment, Govt of India)
(An ISO 9001:2015 Institute)

Manovikas Nagar, Secunderabad-500 009, Telangana
Tel.No.: 091-40-27751741-745; Fax No. 091-040-27750198
Website: www.niepid.nic.in, Email: nimhacademlcs@gmail.com

ADMISSION NOTIFICATION 2024-25

The Director, NIEPID invites applications for the Diploma in Indian Sign Language Interpretation (DISLI) course of 2 years. Interested candidates may submit their applications in prescribed format latest by **20.08.2024**. Counseling for admissions will be held on **26.08.2024** and classes will commence from **02.09.2024**.

Eligibility & other details:
Senior Secondary (10+2) or equivalent with a minimum of 50% marks
Functional hands
Fluency in at least one language
Normal hearing
Fee:
See detailed notification for fee details. The fee is waived off for PwD candidates and their parents.
Stipend:
DISLI students will receive a monthly stipend of Rs. 2000/-
Visit www.niepid.nic.in for the detailed notification, application details, and fee details.

GUJARAT COTEX LIMITED
Where Information, Innovation and Technology are the Key words

Regd. Office: Shop No. 4, 1st Floor, Shanti Complex, Opp. Patel Petrol Pump, Amli, Silvassa - 396230. M. 93279 77729
Email: jayprabha@hotmail.com, Website: www.gclsurat.com, Corporate Identity Number: L17119DN1996PLC000116

Extract of Un-Audited Financial Result for Period Ended 30/06/2024 Rs. In Lakhs

Particulars	Quarter Ended 30/06/2024	Year Ended 31/03/2024	Quarter Ended 30/06/2023
Total income from operations	712.72	1690.72	489.58
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	20.14	26.03	1.44
Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	20.14	24.57	1.44
Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	20.14	23.85	1.44
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	20.14	23.85	1.44
Equity Share Capital	712.20	712.20	712.20
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	0.00	0.00	-48.32
Earnings Per Share (of Rs. 10/- each)-			
1. Basic:	0.03	0.13	0.00
2. Diluted:	0.00	0.13	0.00

Note: The above is an extract of the detailed format of un-audited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the un-audited Financial Results are available on the website of the Stock Exchange at <http://www.bseindia.com> and the listed entity at <http://www.gujcotex.com>

For Gujarat Cotex Limited
Sd/-
Shaileshkumar Jayantkumar Parekh
Managing Director (DIN: 01246270)

Place: Surat
Date: 27/07/2023

एनटीपीसी NTPC Limited
(A Govt. of India Enterprise)

CIN: L40101DL1975GOI007966
Regd. Office: NTPC Bhawan, SCOPE Complex, 7, Institutional Area, Lodi Road, New Delhi-110 003. Tel. no.: 011-24360959 Fax: 011-24360241
Email: csntpc@ntpc.co.in • Website: www.ntpc.co.in

Intimation regarding 48th Annual General Meeting (AGM) and Record Date for payment of Final Dividend

It is hereby informed that the 48th AGM of NTPC Limited will be held on **Thursday, 29th August, 2024 at 10:30 A.M.** through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) in line with the applicable provisions of the Companies Act, 2013 and rules made thereunder read with General Circulars dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020, 13th January, 2021, 14th December, 2021, 05th May 2022, 28th December, 2022 and other relevant circulars including circular dated 25th September, 2023 issued by the Ministry of Corporate Affairs ('MCA'). In line with aforesaid MCA Circulars and SEBI circular dated 5th January, 2023 and 6th October, 2023, Annual Report along with notice of 48th AGM will be sent only through electronic mode to those shareholders whose email addresses are registered with the Company/ depository participant/depository.

Notice and Annual Report 2023-24 will also be made available on the Company's website www.ntpc.co.in and websites of the Stock Exchanges, i.e., BSE Limited and National Stock Exchange of India Limited at www.bseindia.com and www.nseindia.com respectively.

Manner of casting vote(s) through e-voting: In terms of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014, the Resolutions for consideration at the 48th AGM will be transacted through remote e-voting and e-voting during the AGM. **The Company has engaged services of National Securities Depository Limited (NSDL) for facilitating voting through electronic means.** Shareholders who hold shares in physical form or who have not registered their e-mail addresses and wish to participate in the AGM or cast their votes through remote e-voting or e-voting during the meeting may participate in the AGM by following instructions given in the Notice of AGM.

Manner of registering / updating email ID & Bank Details: Shareholders who have not registered their email IDs and Bank Account details are hereby requested to register the same in following manner:

For shareholders holding shares in Physical Mode	For updating email ID	For updating Bank account
Please send a request letter signed by the first holder with following details to the RTA of the Company by post at M/s Beetal Financial & Computer Services Pvt. Ltd. at 3rd Floor, Beetal House, 99, Madangir, Delhi-110062 or through email at ntpc@beetalfinancial.com with following details/documents:	1. Folio No. 2. Name of Shareholder 3. Self-attested copy of PAN 4. Self attested copy of AADHAR/Driving License/Voter Card/Passport (Signature should match with the specimen signature available with the Company/RTA)	In addition to details required for updating email, following details/documents are required : 1. Bank Account details like Bank Account number, Name of the Bank & Branch, MICR Code/ IFSC Code, Card/Passport 2. Cancelled Cheque bearing the name of the Member or first holder, in case shares are held jointly
For shareholders holding shares in Demat Mode	Shareholders can update email IDs, mobile numbers and Bank Account details by contacting their respective Depository Participants as per the process advised by them.	

Record Date for Payment of Final Dividend :
Notice is hereby given that the Company has fixed **Wednesday, 7th August, 2024** as the Record date for the purpose of payment of final dividend for the financial year 2023-24, if approved by the Shareholders in the upcoming Annual General Meeting of the Company.

TDS on Dividend:
Shareholders may note that in terms of the provisions of the Income Tax Act, 1961 ("the Act") as amended by the Finance Act, 2020, dividend paid or distributed by a Company on or after 1st April, 2020 is taxable in the hands of the Shareholders. The Company is, therefore, required to deduct tax at source at the time of payment of dividend to the Shareholders. In order to enable us to determine the appropriate TDS rate, as applicable, Shareholders are requested to submit necessary forms/documents in accordance with the provisions of the Income Tax Act up to 16th August 2024. The necessary documents, as applicable, are required to be emailed at tdsdiv@ntpc.co.in and dividend.ntpc@taxpc.com, to enable the Company to determine the appropriate TDS rates. For the detailed process, please visit website of the Company <https://www.ntpc.co.in/investor-updates/dividend-tds-communication>.

In case of any further assistance in this regard, Shareholders may contact RTA or Company at above mentioned email/address.

For NTPC Limited
Sd/-
Ritu Arora
Company Secretary

Date: 29.07.2024
Place: New Delhi

Leading the Power Sector

Rajoo RAJOO ENGINEERS LIMITED
excellence in extrusion

Registered Office : Rajoo Avenue, Survey No. 210, Plot No.1 Industrial Area, Veraval (Shapur), Rajkot, Gujarat – 360024
Corporate Identity Number (CIN) : L27100GJ1986PLC009212
Tel. No. : +91 97129 62704 / 52701 / 32706
E-mail : compliances@rajoo.com | Website : www.rajoo.com
Contact Person : Mr. Rohit Soljira, Company Secretary & Compliance Officer

NOTICE OF RECORD DATE FOR BONUS ISSUE OF EQUITY SHARES

The Board of Directors at its meeting held on Friday, June 28, 2024 recommended and subsequently the shareholders of the Company approved the bonus issue of equity shares through postal ballot as on Sunday, July 28, 2024 in the ratio of 1:1 i.e. 1 (One) New fully paid Equity Share for every 1 (One) existing Equity Share held as on Record Date by the shareholder.

For the purpose of ascertaining the names of equity shareholders entitled to Bonus Shares, the Board of Directors has fixed Thursday, August 08, 2024 as Record date. In this regard, Bonus Equity Shares will be issued to the Equity Shareholders, whose names appear in the Register of Members/Beneficial Owners of the Company/Depositories as on record date.

The Bonus Equity Shares, once allotted, shall rank pari-passu in all respects with and carry the same rights as the existing fully paid-up Equity Shares of the Company.

The above details are also available on the website of the Company (www.rajoo.com), and on the website of the Stock Exchange (www.bseindia.com)

For Rajoo Engineers Limited
Sd/-
Ms. Khushboo C. Doshi
Managing Director
DIN : 0025581
Registered Office : Rajoo Avenue, Survey No. 210, Plot No.1 Industrial Area, Veraval (Shapur), Rajkot, Gujarat – 360024
Date: 28/07/2024
Place : Veraval (Shapur)

About Rajoo
Based in Rajkot, Rajoo Engineers Limited, having made a modest beginning in 1986, has today emerged as an undisputed global player in blown film and sheet extrusion lines. Owing to its focused efforts in blown film, sheet extrusion lines and thermoformers, the Company enjoys a premium market position in this segment. Being a technology driven Company, product innovations, world-class quality, state-of-the-art workmanship, increased energy efficiency and high levels of sophistication and automation have become the hallmark of Rajoo products during all these years, positioning the Company's products on a global platform, competing with the established world leaders. With representations in many countries of the world and customers in over 70 countries, the Company's exports have multiplied after its debut in the international market in 1990. (www.rajoo.com)

CAMEX LIMITED
CIN : L17100GJ1989PLC013041
Registered Office: Camex House, 2nd Floor, Stadium-Commerce Road, Navrangpura, Ahmedabad-380009. • Tel: +91-79-26462261. • Fax: +91-79-26462260
Website: <http://www.camextd.com> • Email: cs@camextd.com

NOTICE OF THE 35th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 35th Annual General Meeting (AGM) of the Company will be held on **Wednesday, August 21, 2024 at 2.00 p.m.** through Video Conference ("VC")/Other Audio Visual Means ("OAVM") to transact the businesses as set out in the Notice of 35th AGM.

The Company has sent the Annual Report for the Financial Year 2023-24 along with the Notice convening AGM on Monday, July 29, 2024 through electronic mode only to the members whose email addresses are registered with the Company and with the Share Transfer Agent, M/s. Link Intime India Private Limited and/or Depositories in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs, vide Circular No. 14/2020 dated April 8, 2020, Circular No. 17/2020 dated April 13, 2020, Circular No. 20/2020 dated May 05, 2020 and Circular No. 02/2021, Circular No. 22/2020 dated June 15, 2020, Circular No. 33/2020 dated September 28, 2020, Circular No. 39/2020 dated December 31, 2020, Circular No. 02/2021 dated January 13, 2021, Circular No. 10/2021 dated June 23, 2021, Circular No. 02/2022 dated May 5, 2022 and Circular No. 11/2022 dated December 28, 2022 and Circular No. 09/2023 dated September 25, 2023 ("MCA Circulars") and Circular No. SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 dated May 12, 2020 and Circular No. SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 dated January 15, 2021, Circular No. SEBI/HO/DDHS/DDHS_Div2/P/CIR/2022/079 dated 3rd June, 2022 and SEBI/HO/CFD/PoD-2/P/CIR/2023/4 dated January 5, 2023, SEBI/HO/CFD/CFD-PoD-2/P/CIR/2023/167 dated October 07, 2023 issued by the Securities and Exchange Board of India (SEBI), has allowed the Companies to conduct the Annual General Meeting ("AGM") through Video Conferencing (VC) or Other Audio Visual Means (OAVM) for the financial year 2024. In accordance with the said circulars of MCA, SEBI and applicable provisions of the Companies Act, 2013 (the "Act") and SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 (the "SEBI Listing Regulations"), the 35th AGM of the Shareholders will be held through video conferencing (VC) or other audio-visual means (OAVM) without physical presence of members at a common venue. Hence, Shareholders can attend and participate in the ensuing AGM through VC/OAVM. Central Depository Services (India) Limited ("CDSL") will be providing facility for voting through remote e-voting, participation in the AGM through VC/OAVM facility and e-voting during the AGM. The procedure for participating in the meeting through VC/OAVM is explained at Note No 1 to X below and is also available on the website of the Company at www.camextd.com.

In accordance with the aforesaid Circulars, Notice of the AGM along with the Annual Report 2023-24 is being sent only by electronic mode to those Members whose e-mail addresses are registered with the Company/Depositories. Members may note that the Notice of AGM and Annual Report 2023-24 will also be available on the Company's website - www.camextd.com, website of the Stock Exchange i.e. BSE Limited at www.bseindia.com, and the AGM Notice will also be made available on the website of CDSL (agency for providing the Remote e-voting facility and e-voting facility during the AGM) i.e. www.evotingindia.com. Members can attend and participate in the AGM through the VC/OAVM facility only. The instructions for joining the AGM are provided in the notice of AGM. Members attending the meeting through VC/OAVM shall be counted for the purpose of reckoning the quorum as per Section 103 of the Companies Act, 2013.

NOTICE is hereby further given that pursuant to Section 91 of the Companies Act, 2013 read with rules made there under and as per Regulation 42 of SEBI (LODR) Regulations, 2015, the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Saturday, August 15, 2024 to Wednesday, August 21, 2024 (both days inclusive), for the purpose of 35th AGM of the Company. Pursuant to provisions of Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015, the Company is providing its members the facilities to cast their vote by 'Remote e-voting' as under and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said Notice. The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made there under are given here under:

Sr. No.	Date of completion of dispatch of Notice of AGM through email only	Monday, July 29, 2024
1.	Date & Time of commencement of Remote e-voting	Saturday, August 17, 2024 at 9.00 a.m.
2.	Date & Time of end of Remote e-voting	Tuesday, August 20, 2024 at 5.00 p.m. The remote e-voting module shall be disabled by CDSL thereafter. Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
3.	Cut-off date for determining rights of entitlement of Remote e-voting and e-voting during the AGM	Wednesday, August 14, 2024 The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Wednesday, August 14, 2024 ("cut-off date")
4.	Those persons who have acquired shares and have become members of the Company after emailing of notice of AGM by the Company and whose names appear in the Register of Members of the Company in the statement of beneficial owners maintained by depositories as on cut-off date may obtain the log in ID and password by sending a request to helpdesk helpdesk.evoting@cdslindia.com . However, if he/she is already registered with CDSL for remote e-voting, then he/she can use his/her existing User ID and password for casting the votes.	
5.	The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and process to register e-mail addresses for members who have not registered their email addresses is provided in the Notice of the 35th AGM.	
6.	Remote e-voting shall not be allowed beyond	After 5:00 p.m. on August 20, 2024
7.	Manner of casting e-votes on resolutions during AGM (VC/OAVM)	E-voting facility will be available during AGM. Members who have already cast their vote by remote e-voting prior to the AGM may remain present at AGM through VC/OAVM but shall not be entitled to cast their e-vote again during AGM.
8.	Electronic Voting system & VC/OAVM platform provider	Central Depository Services (India) Limited www.evotingindia.com
9.	Contact details of person responsible to address the grievances connected with e-voting system	Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai-400013 Email: helpdesk.evoting@cdslindia.com Phone: 022-23058542 / 43 / 022-23058738 and 1800 22 55 33.

In case Member(s) have not registered their e-mail addresses with the Company/Depository, please follow the below instructions to register e-mail address for obtaining Annual Report and login details for e-voting –

- For members holding shares in Physical mode – please provide necessary details like Folio No., scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card) by email our RTA, Link Intime India Private Limited on their Email id: ahmedabad@linkintime.com; rt.helpdesk@linkintime.com
- Members holding shares in Demat mode can get their Email ID registered by contacting their respective Depository Participant or by email to ahmedabad@linkintime.com; rt.helpdesk@linkintime.com.

The 35th AGM Notice will be sent to the shareholders holding shares as on cut off for the dispatch in accordance with the applicable laws on their registered e-mail addresses in due course.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or write an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43 / 022-23058738 and 1800 22 55 33.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Manager, Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futrex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai-400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43 / 022-23058738 and 1800 22 55 33.

By order of the Board of directors
For: **CAMEX LIMITED**
Sd/-
Chandraprakash Chopra
Chairman & Managing Director (DIN: 00375421)

Place: Ahmedabad
Date: July 29, 2024

TATA CAPITAL LIMITED
 Registered Address: Tower A, 11th Floor, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai-400013, India
 Old Padra Road, Beside Gail India Office, Vadodara-390015.

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTY
 (Under Rule 8(6) of the Security Interest (Enforcement) Rules 2002)

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

LOAN ACCOUNT NO: TCFLA020200011062232; MS. AMI EXPORT OVERSEAS

This is to inform that Tata Capital Ltd. (TCL) is a non-banking finance company and incorporated under the provisions of the Companies Act, 1956 and having its registered office at Peninsula Business Park, Tower A, 11th Floor, Ganpatrao Kadam Marg, Lower Parel, Mumbai-400013 and a branch office at various places at Gujarat (Branch). That vide Orders dated 24.11.2023, the National Company Law Tribunal (NCLT) Mumbai has duly sanctioned the Scheme of Arrangement between Tata Capital Financial Services Limited ("TCFSL") and Tata Cleantech Capital Limited ("TCCL") as transferees and Tata Capital Limited ("TCL") as transferee under the provisions of Sections 230 to 232 read with Section 66 and other applicable provisions of the Companies Act, 2013 ("Said Scheme"). In terms thereof, TCFSL and TCCL (Transferor Companies) along with its undertaking have merged with TCL, as a going concern, together with all the properties, assets, rights, benefits, interest, duties, obligations, liabilities, contracts, agreements, securities etc. w.e.f. 01.01.2024, in pursuance of the said Order and the Scheme, all the facility documents executed by TCFSL and all outstanding in respect thereof stood transferred to Applicant Company and thus the TCL is entitled to claim the same from the (Borrowers/Co-Borrowers) in terms thereof.

Notice is hereby given to the public in general and in particular to the below Borrower/Co-Borrower that the below described immovable property mortgaged to Tata Capital Limited (Secured Creditor/TCL), the Possession of which has been taken by the Authorized Officer of Tata Capital Limited (Secured Creditor), will be sold on 21st Day of August 2024 "As is where is basis" & "As is what is and whatever there is & without recourse basis".

Whereas the sale of secured asset is to be made to recover the secured debt and whereas there was a due of Rs. 25,08,802/- (Rupees Twenty Five Lakh Eight Thousand Eight Hundred and Two Only) due as on 08th May 2023 vide Loan Account bearing No. TCFLA020200011062232 demanded by issuing notice under Section 13(2) dated 08th May 2023 from Borrower & Co-Borrowers Guarantors i.e., (1) M/s. AMI Export Overseas, Through its Proprietor Mr. Amarshin Kesharlal Rajput, having address at Shop No.11, Productivity House, Productivity Road, Alkapuri, Baroda-390007, (2) Mr. Amarshin Kesharlal Rajput and (3) Mrs. Rekhaben Amarshin Rajput, both having address at Plot No.3, Pusti Bungalow, Bn. Kalyanesh Complex, Goin Road, Vadodra, Gujarat-390021, Also Add Shop No.11, Productivity House, Productivity Road, RS No. 526/1, C Tilkra 7/7, City Survey No. 1961 and 1962 of Village Moje: Kasba Vadodara, Dist: Vadodara-390007.

Notice is hereby given that, in the absence of any postponement/discontinuance of the sale, the said property shall be available for sale along with secured asset until and unless specifically described in auction sale notice. The sale will also be stopped if, amount due as aforesaid, interest and costs (including the cost of the sale) are tendered to the Authorized Officer or proof is given to his satisfaction that the amount of such secured debt, interest and costs has been paid. At the sale, the public generally is invited to submit their tender personally. No officer or other person, having any duty to perform in connection with this sale shall, however, directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the property sold. The sale shall be subject to the rules/conditions prescribed under the SARFAESI Act, 2002. The E-auction will take place through portal <https://disposal.hub.com> on 21st Day of August 2024 between 2.00 PM to 3.00 PM with unlimited extension of 10 minutes each. All the bids submitted for the purchase of the property shall be accompanied by Earnest Money as mentioned above by way of Demand Draft favoring the "TATA CAPITAL LIMITED" payable at Vadodara. Inspection of the property may be done on 09th Day of August 2024 between 11.00 AM to 5.00 PM.

Note: The intending bidders may contact the Authorized Officer Mr. Harangad Bhogal and Mr. Anurodh Julius, Email: id: harangad.bhogal@tatacapital.com/ anurodh.julius@tatacapital.com, Mobile No.-918637683008/9657438008.

For detailed terms and conditions of the Sale, please refer to the link provided in secured creditor's website, i.e. <https://bit.ly/3y4AHak>, or contact Authorized Officer or Service Provider- NexGen Solutions Private Limited.

Place: Vadodara (Gujarat) Sd/- Authorized Officer Tata Capital Limited

RAJOO RAJOO ENGINEERS LIMITED
 excellence in extrusion

Registered Office : Rajoo Avenue, Survey No. 210, Plot No.1 Industrial Area, Veraval (Shapur), Rajkot, Gujarat - 360024
 Corporate Identity Number (CIN) : L27100GJ1986PLC009212
 Tel. No. : +91 97129 62704 / 52701 / 32706
 E-mail : compliances@rajoo.com | Website : www.rajoo.com
 Contact Person : Mr. Rohit Soljita, Company Secretary & Compliance Officer

NOTICE OF RECORD DATE FOR BONUS ISSUE OF EQUITY SHARES

The Board of Directors at its meeting held on Friday, June 28, 2024 recommended and subsequently the shareholders of the Company approved the bonus issue of equity shares through postal ballot as on Sunday, July 28, 2024 in the ratio of 1:1 i.e. 1 (One) New fully paid Equity Share for every 1 (One) existing Equity Share held as on Record Date by the shareholder.

For the purpose of ascertaining the names of equity shareholders entitled to Bonus Shares, the Board of Directors has fixed Thursday, August 08, 2024 as Record date. In this regard, Bonus Equity Shares will be issued to the Equity Shareholders, whose names appear in the Register of Members/Beneficial Owners of the Company/Depositories as on record date.

The Bonus Equity Shares, once allotted, shall rank pari-passu in all respects with and carry the same rights as the existing fully paid-up Equity Shares of the Company.

The above details are also available on the website of the Company (www.rajoo.com), and on the website of the Stock Exchange (www.bseindia.com)

For Rajoo Engineers Limited
 Sd/-
Ms. Khushboo C. Doshi
 Managing Director
 DIN : 0025581
 Registered Office :
 Rajoo Avenue, Survey No. 210, Plot No.1 Industrial Area, Veraval (Shapur), Rajkot, Gujarat - 360024

Date: 28/07/2024
 Place : Veraval (Shapur)

About Rajoo

Based in Rajkot, Rajoo Engineers Limited, having made a modest beginning in 1986, has today emerged as an undisputed global player in blown film and sheet extrusion lines. Owing to its focused efforts in blown film, sheet extrusion lines and thermoformers, the Company enjoys a premium market position in this segment. Being a technology driven Company, product innovations, world-class quality, state-of-the-art workmanship, increased energy efficiency and high levels of sophistication and automation have become the hallmark of Rajoo products during all these years, positioning the Company's products on a global platform, competing with the established world leaders. With representations in many countries of the world and customers in over 70 countries, the Company's exports have multiplied after its debut in the international market in 1990. (www.rajoo.com)

POSSESSION NOTICE - (for immovable property) Rule 8(1)

Whereas, the undersigned being the Authorized Officer of IIFL Home Finance Limited (Formerly known as India Infoline Housing Finance Ltd.) (IIFL, HFL) under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13(2) read with Rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002, a Demand Notice was issued by the Authorized Officer of the company to the borrowers / co-borrowers mentioned herein below to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him under Section 13(4) of the said Act read with Rule 8 of the said rules. The borrower in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of IIFL, HFL for an amount as mentioned herein under with interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, if the borrower clears the dues of the "IIFL, HFL" together with all costs, charges and expenses incurred, at any time before the date fixed for sale or transfer, the secured assets shall not be sold or transferred by "IIFL, HFL" and no further step shall be taken by "IIFL, HFL" for transfer or sale of the secured assets.

Name of the Borrower/Co-Borrower	Description of secured asset (Immovable property)	Total Outstanding Dues (Rs.)	Date of Demand Notice	Date of Possession
Mr. Bhagpal Thakor Mr. Gandaj Verahji Thakor Mrs. Kuvaben Gandaj Thakor (L.10347100)	All that piece and parcel of Property Bearing: Residential House City Survey No. 730/94 paiki, Sheet No. 54, Mouje Harji, Taluka Harji, Dist. Patan, Gujarat, 384240 Area Admeasuring (IN SQ. FT.): Property Type: Land, Area, Carpet Area, Build Up Area Property Area: 738.20, 880.00, 983.00	Rs.1948000.00/- (Rupees Nineteen Lakh Eighty Thousand Only)	08-May-2024	25-July-2024
Mr. Thakor Harji Mrs. Jyotsnaben (L.10261338)	All that piece and parcel of Property Bearing: Messar Milkot No. 557/2, Serial No. 589, Messar, Taluk: Saraswati, District: Patan, Gujarat, India, 384273 Area Admeasuring (in Sq. Ft.): Property Type: Land Area Property Area: 625.00	Rs.589845.00/- (Rupees Five Lakh Fifty Eight Thousand Six Hundred and Forty Five Only)	08-May-2024	25-July-2024

For further details please contact to Authorized Officer at Branch Office: FF 201, 22, 23, Kushiwan Plaza, Opp District Court, Patan-384265, or Corporate Office: Plot No.98, Phase-VI, Jyotiy Vihar, Gurgaon, Haryana. Place: Patan Date: 30/07/2024 Sd/- Authorized Officer, For IIFL Home Finance Limited

CAPRI GLOBAL CAPITAL LIMITED
 Registered & Corporate Office : 502, Tower-A, Peninsula Business Park, Senapati Bapat Marg, Lower Parel, Mumbai-400013, Circle Office : 6B, 2nd Floor, Pusa Road, New Delhi - 110060

DEMAND NOTICE

Under Section 13(2) of the Securitization And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 read with Rule 3 (1) of the Security Interest (Enforcement) Rules, 2002. The undersigned is the Authorized Officer of Capri Global Capital Limited, (CGCL) under Securitization And Reconstruction Of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 (the said Act). In exercise of powers conferred under section 13(2) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer has issued Demand Notices under section 13(2) of the said Act, calling upon the following Borrower(s) (the "said Borrower(s)"), to repay the amounts mentioned in the respective Demand Notice(s) issued to them that are also given below. In connection with above, Notice is hereby given, once again, to the said Borrower(s) to pay to CGCL, within 60 days from the publication of this Notice, the amounts indicated herein below, together with further applicable interest from the date(s) mentioned below till the date of payment and/or realization, payable under the loan agreement read with other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following assets have been mortgaged to CGCL by the said Borrower(s) respectively.

S. No.	Name of the Borrower(s)/ Guarantor(s)	Demand Notice Date and Amount	Description of secured asset (Immovable property)
1.	(Loan Account No. LNMSUD000019788 (Old) 8040005932402 (New) & LNBLSD00001625 (Old) 8020005421618 (New) (Surentranagar Branch) Vijay (Surentranagar Branch) Vijay (Surentranagar Branch) Vijay Pravinaben Vijayhai Rajpura (Co-Borrower)	27-Jul-24 Rs. 2121866	All that Piece and Parcel of Property bearing Commercial Shop No. A and B known as Bhavya Sales Agencies, on Dhrangdhara Revenue Survey No. 944/p1, Paiki Plot No. 20, Sub Plot No. 20B, Ground Floor with terrace rights, both shops admeasuring 12.44 Sq. Mts. Each, total land of both shop admeasuring 24.88 Sq. Mts., situated at Sai Palace, Off. Halvad Road, Dhrangdhara, Surentranagar, Gujarat - 363310 Bounded As (Shop No. A); East By: Sub Plot No. 20/A Shop No. C West By: Sub Plot No. 20/B Shop No. B North By: 12 Ms. Road South By: Plot No. 19 Bounded As (Shop No. B); East By: Sub Plot No. 20/B Shop No. A West By: Sub Plot No. 20/B Shop No. C North By: 12 Mts. Road South By: Plot No. 19

If the said Borrowers shall fail to make payment to CGCL as aforesaid, CGCL shall proceed against the above secured assets under Section 13(4) of the Act and the applicable Rules, entirely at the risks of the said Borrowers as to the costs and consequences. The said Borrowers are prohibited under the Act from transferring the aforesaid assets, whether by way of sale, lease or otherwise without the prior written consent of CGCL. Any person who contravenes or abets contravention of the provisions of the said Act/Rules made the reunder, shall be liable for imprisonment and/or penalty as provided under the Act.
 Place : Surenagar Date : 30/07/2024 Sd/- (Authorized Officer) For Capri Global Capital Limited (CGCL)

AAVAS FINANCIERS LIMITED
 (Formerly known as AU HOUSING FINANCE LIMITED) (CIN:L65922RJ2011PLCC034297)
 Regd. & Corp. Office: 201-202, 2nd Floor, South End Square, Mansarovar Industrial Area, Jaipur. 302020

POSSESSION NOTICE

Whereas, The undersigned being the Authorized Officer of AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED") under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred upon me under section 13(2) read with Rule 9 of the Security Interest (Enforcement) Rules 2002, issued a Demand Notice calling upon the borrowers mentioned herein below to repay the amount mentioned in the respective notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, undersigned has taken possession of the properties described herein below in exercise of powers conferred on me under Section 13(4) of the said Act read with Rule 9 of the said rules on the dates mentioned as below.

The borrower and Guarantor in particular and the public in general is hereby cautioned not to deal with the properties and any dealings with the property will be subject to the charge of the AAVAS FINANCIERS LIMITED (Formerly known as "AU HOUSING FINANCE LIMITED") for an amount mentioned as below and further interest thereon.

Name of the Borrower	Date & Amount of Demand Notice	Description of Property	Date & Type of Possession
SURESHBHAI KHACHAR, BHUMIKABEN SURESHBHAI KHACHAR (A/c No.) LNRKM08122-230267529	8 Feb 24 Rs. 646532/- 6 Feb 24	Gram Panchayat House no. 8, At - Panchavadi, Tal - Chotila, Dist - Surentranagar PIN: 363520 Admeasuring 789 Sq. Mtr.	Physical Possession Taken on 28 Jul 24

Place : Jaipur Date: 30-07-2024 Authorised Officer Aavas Financiers Limited

BANK OF MAHARASHTRA
 Zonal office Ahmedabad, 1st Floor, Baleshwar Square, Opp. Icon Temple, S G Highway, Ahmedabad-380015. M.: 9998686584
 E-mail: bom1936@mahabank.co.in, cmarb_ah@mahabank.co.in

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES [SEE PROVISION OF RULE 8(6)]

E - AUCTION : 16.08.2024, Time : 01:00 pm to 05:00 pm

E-Auction Sale Notice (15 days) for Sale of Movable/Immovable Assets under the Securitization and Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 read with the proviso to Rule 8(6) of the Security Interest (Enforcement) Rules, 2002.

Notice is hereby given to the public in general and in particular to the Borrower (s) and Guarantor (s) that the below described Movable/Immovable properties mortgaged/charged to the Bank of Maharashtra (Secured Creditor), the Constructive/Symbolic/Physical Possession of which has been taken by the Authorized Officer of Bank of Maharashtra, will be sold on as "As is where is, As is what is and whatever there is basic" on 16.08.2024 (For Sr. No. 1 to 7 i.e From Lot No. 1 to 10), for recovery of dues as mentioned below due to the Bank of Maharashtra (Secured Creditor) from below mentioned borrowers and guarantors. The known encumbrances (if any) along with description of Movable/Immovable properties, reserve price and the EMD are as mentioned in the table.

Sale Notice - Ahmedabad/E-bikray/2024-25/2

Sr. No.	Branch Name / Name and address of Borrowers / Guarantors	Total dues for Recovery of which properties are being sold (Rs.)	Details of the Secured Assets Put for Auction / Sale & Type of Possession with the Bank & Encumbrances	Reserve Price (Value in Lakh) EMD Amt. (Value in Lakh) Bid Increase Amt.
1	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower / Partners : M/s. Sahaj Diamond 1. Mr. Zaverbhai M Kalathiya (Partner & Guarantor), 2. Mr. Miteshi M Kalathiya (Partner & Guarantor), 3. Mr. Chandubhai M Kalathiya (Partner & Guarantor), 4. Legal Heir of Mr. Mavjibhai Mohanbhai Kalathiya/Patel (Partner & Guarantor), 5. Legal Heir of Mr. Harikrishna Zaverbhai Kalathiya (Partner & Guarantor)	Ledger Balance Rs. 2,51,18,140.51/- plus Unapplied interest plus Penal interest and other charges thereon from 24.05.2021 (less recovery made thereafter)	Lot No. 1) All those pieces & parcel of property furnishing at : Plot No. 5 admeasuring 193.32 sq. mtrs with construction thereon admeasuring 149.15 sq. mtrs at Mangalpara, Rev Survey No. 329 paiki at Botad and recorded at Botad Nagar Palika ward No. 5, Property No. 2418, Tal Botad, Dist- Bhavnagar. Together with all the fixtures, furniture	Rs. 33.44
			Lot No. 2) All those pieces & parcel of property furnishing at : Plot No. 7 admeasuring 338.47 sq. mtrs with construction thereon admeasuring 259.55 sq. mtrs situated on land bearing Rev survey No. 332/1 paiki at Botad and recorded at Botad Nagar Palika ward No. 5, Property No. 2333, Tal Botad, Dist- Bhavnagar. Together with all the fixtures, furniture	Rs. 64.00 Rs. 6.50 Rs. 20,000
2	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : Mrs. Rinki Shobharam Bania, Mr. Shobharam Ramdev Bania	Ledger Balance Rs. 48,72,270/- plus Unapplied interest plus Penal interest and other charges from 18.08.2022 (Less recovery made thereafter)	Lot No. 3) All those pieces & parcel of property furnishing Registered Mortgage of Plot No. 4, Shiv Park Society, R S No. 50/2, TP No. 3, FP No. 633, Paiki of CS No. 633/A, Mouje Vadodara Kasba, Near Parvati Park, Behind Datt Mandir, Mahadev Talav, Wadi, Vadodara, Gujarat. Together with all the fixtures, furniture	Rs. 30.61 Rs. 3.10 Rs. 20,000
			Lot No. 4) All those pieces & parcel of property furnishing Vatva, Taluka Vatva, District- Ahmedabad, Survey No. 597/2 admeasuring about 16086 Sq. Mtrs. Survey No. 606 admeasuring about 7386 sq. Mtrs, Survey No. 618 admeasuring about 4553 sq. Mtrs. T.P Scheme No. 80, Final Plot No. 45/1 + 53 + 58/2 total admeasuring about 16830 sq. Mtrs. and Survey No. 607 admeasuring about 16830 sq. Mtrs. and Survey No. 607 admeasuring about 5463 sq. Mtrs, Survey No. 608/3 admeasuring about 608/3 admeasuring about 3237 sq. Mtrs. T.P Scheme No. 80, Final Plot No. 54/1+56 total admeasuring about 22050 sq. Mtrs. N.A Land Block No. C, Flat No. 1205, 12th Floor, carpet area admeasuring about 39.38 sq. Mtrs and wash area admeasuring about 1.06 sq. Mtrs and balcony 1.49 sq. Mtrs and undivided share of land admeasuring about 17.4722 sq. Mtrs. in the scheme of Laxmi Niwas, Constructed and developed by Laxmi Infrastructure. Together with all the fixtures, furniture	Rs. 9.93 Rs. 1.00 Rs. 20,000
3	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No. 8989080944 Borrower : Aarya Construction (Proprietorship Firm of Late Mukeshchandra Yashvantlal Daxini), Mrs. Madhuben Daxini (As Legal Heirs (Mother) of Deceased Proprietor and Guarantor Mr. Mukeshchandra Yashvantlal Daxini of Borrower Firm), Mrs. Purviben Daxini (As Legal Heirs (Wife) of Deceased Proprietor and Guarantor Mr. Mukeshchandra Yashvantlal Daxini of Borrower Firm), Ms. Rutika Daxini (As Legal Heirs (Daughter) of Deceased Proprietor and Guarantor Mr. Mukeshchandra Yashvantlal Daxini of Borrower Firm)	Ledger Balance Rs. 85,00,867/- plus Unapplied interest plus Penal interest and other charges from 13/06/2021 (Recovery made by E-Auction on dated-17.01.2023 of Rs. 14,29,000/- One Mortgaged Property sold) (less recovery made thereafter)	Lot No. 5) All those pieces & parcel of property furnishing Mouje: Vatva, Taluka Vatva, District- Ahmedabad, Survey No. 597/2 admeasuring about 16086 Sq.Mtrs. Survey No. 606 admeasuring about 7386 sq.Mtrs, Survey No. 618 admeasuring about 4553 sq.Mtrs. T.P Scheme No. 80, Final Plot No. 45/1 + 53 + 58/2 total admeasuring about 16830 sq. Mtrs. and Survey No. 607 admeasuring about 16830 sq. Mtrs. and Survey No. 607 admeasuring about 5463 sq. Mtrs, Survey No. 608/3 admeasuring about 608/3 admeasuring about 3237 sq. Mtrs. T.P Scheme No. 80, Final Plot No. 54/1+56 total admeasuring about 22050 sq. Mtrs. N.A Land Block No. C, Flat No. 1305, 13th Floor, carpet area admeasuring about 39.38 sq. Mtrs and wash area admeasuring about 1.06 sq. Mtrs and balcony 1.49 sq. Mtrs and undivided share of land admeasuring about 17.4722 sq. Mtrs. in the scheme of Laxmi Niwas, Constructed and developed by Laxmi Infrastructure. Together with all the fixtures, furniture	Rs. 9.93 Rs. 1.00 Rs. 20,000
			Lot No. 6) All those pieces & parcel of property furnishing with construction & fixture there being & lying at Factory land and building (total built-up area- 5794.00 Sq. Meter) admeasuring 6446.00 Square Meter situated at Revenue Survey No. 88, Paiki 1 Paiki 1, Aniyar Chokadi, Maliya-Halvad Highway, Village-Rapar, Morbi, Gujarat-363630. Together with all the fixtures, furniture	Rs. 252.03 Rs. 25.25 Rs. 1,00,000

Lot No.	Branch Name / Name and address of Borrowers / Guarantors	Total dues for Recovery of which properties are being sold (Rs.)	Details of the Secured Assets Put for Auction / Sale & Type of Possession with the Bank & Encumbrances	Reserve Price (Value in Lakh) EMD Amt. (Value in Lakh) Bid Increase Amt.
4	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : SilverSun Sanitaryware LLP through its Partner & Guarantor : 1. Mr. Kailashbhai Dayalal Merja, 2. Mr. Nitinbhai Vasharambhai Shanghani, 3. Mr. Ashoknhal Dayabhai Merja, 4. Mr. Ravi Hareeshbhai Kaila, 5. Mr. Divyesh Harjivanbhai Kaila, 6. Mr. Darshan Rameshbhai Kaila, 7. Mr. Chhaganbhai Makasana, 8. Mr. Devraj Chhaganbhai Makasana, 9. Mr. Satishbhai Prabhulal Detroja, 10. Mr. Avcharbhai Savjibhai Makasana, 11. Mr. Rajeshbhai Mansukhbhai Sherasiya, 12. Mr. Yuvraj Dineshbhai Bavara, 13. Mr. Brajesh Kamleshbhai Raval, 14. Mrs. Lataben Kailashbhai Raval, 15. Ms. Tejasvi Kailashbhai Merja, 16. Ms. Nishita Kailashbhai Merja, 17. Mrs. Prafullaben Darshankumar Kaila 18. Mrs. Rekhaben Devrajbhai Makasana 19. Mrs. Pritiben Prakashbhai Hulani	Ledger Balance Rs. 2,79,89,223/- plus Unapplied interest plus Penal interest and other charges from 18.10.2022 (less recovery made thereafter)	Physical Possession	Rs. 252.03
			The Plant & Machinery situated in factory	Rs. 24.00
5	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : Itawa Plus Ceramic LLP through its Partner & Guarantor : 1. Narendra Bharvati Park, Behind Datt Mandir, Mahadev Talav, Wadi, Vadodara, Gujarat. Together with all the fixtures, furniture	Ledger Balance Rs. 3,97,17,828/- plus Unapplied interest plus Penal interest and other charges from 31.01.2023 (less recovery made thereafter)	Physical Possession	Rs. 277.76
			Physical Possession	Rs. 27.80
6	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : Shrushti Manufacturing and Co (Proprietorship Firm of Pravin Khemchand Makwana), Mr. Pravin Khemchand Makwana (Mortgagor)	Ledger Balance Rs. 45,43,620/- plus Unapplied interest plus Penal interest and other charges from 31.08.2021 (less recovery made thereafter)	Physical Possession	Rs. 1,00,000
			Physical Possession	Rs. 88.57
7	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : M/s. El Sol Energy System through its Proprietor Mr. Minip Madhukar Patel, Mr. Minip Madhukar Patel Proprietor of M/s El Sol Energy Systems (Borrower, Guarantor and Mortgagor), Mr. Minip Madhukar Patel (Legal Heirs of Deceased Mr. Madhukar Hiralal Patel) (Guarantor)	Ledger Balance Rs. 1,98,76,293/- plus Unapplied interest plus Penal interest and other charges from 06.03.2023 (less recovery made thereafter)	Physical Possession	Rs. 0.90
			Physical Possession	Rs. 20,000
7	Branch : Asset Recovery Branch Mr. Ashutosh Rajan, Chief Manager Mob. No.: 8989080944 Borrower : M/s. El Sol Energy System through its Proprietor Mr. Minip Madhukar Patel, Mr. Minip Madhukar Patel Proprietor of M/s El Sol Energy Systems (Borrower, Guarantor and Mortgagor), Mr. Minip Madhukar Patel (Legal Heirs of Deceased Mr. Madhukar Hiralal Patel) (Guarantor)	Ledger Balance Rs. 1,98,76,293/- plus Unapplied interest plus Penal interest and other charges from 06.03.2023 (less recovery made thereafter)	Physical Possession	Rs. 88.57
			Physical Possession	Rs. 20,000

STATUTORY -15- DAYS SALE NOTICE RESPECTIVELY UNDER SARFAESI ACT, 2002

1. The auction sale for all properties will be online through website <https://ebkraj.in/auction-psb> [Contact No. 8291220220, Email : support@ebkraj.in/psballiance.com] on 16.08.2024 (For Sr No. 1 to 7 i.e Lot No. 1 to 10) from 1:00 PM to 05:00 PM (IST) with unlimited extensions of 5 minutes duration each. Last date of submission of bid/tender with EMD is 15.08.2024 upto 04:00 PM. The intending purchasers can inspect the properties with prior appointment at his/her expenses from 12.08.2024 to 13.08.2024 between 12:00 PM to 4:00 PM. For Prior appointment, please contact to the Concerned Branch. Bidders shall improve their offers as mentioned above during online bidding for Properties.

2. For Detailed terms and conditions of the sale, please refer to the link "http://bankofmaharashtra.in/properties_for_sale" provided in the Bank's website & on E-Bikray Portal (<https://ebkraj.in/auction-psb>)

Date : 26.07.2024, Place : Ahmedabad Sd/- Authorised Officer under Sarfaesi Act, 2002, Bank of Maharashtra, Ahmedabad Zone

Ahmedabad